

બ્રેમ્પટનમાં 2019 ની સિવિક હોલિડે (જાહેર રજા)

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જુલાઈ 31, 2019) – આ વર્ષે, સિવિક હોલિડે (જાહેર રજા) સોમવાર, ઓગસ્ટ 5 નાં રોજ આવશે. પરિણામ સ્વરૂપે, શહેરની સંખ્યાબંધ સેવાઓ અનુપલબ્ધ રહેશે અથવા ઘટાડેલા સેવા સ્તરો સાથે કાર્યરત રહેશે.

બ્રેમ્પટન સીટી હોલ ઓગસ્ટ 5 નાં રોજ બંધ રહેશે. રહેવાસીઓ આ સમય દરમિયાન રૂબરૂમાં મેરેજ લાઈસન્સીસ મેળવવા અરજી કરી શકશે નહિ, નાગરિક લગ્ન સમારોહોનું બુકિંગ કરાવી શકશે નહિ, પાર્કિંગ દંડ ચૂકવી શકશે નહિ અથવા પરમીટ્સ મેળવવા કે તાજી (રિન્યુ) કરાવવા અરજી કરી શકશે નહિ અથવા ધંધાકીય પરવાનાઓ મેળવવા કે તાજી કરાવવા અરજી કરી શકશે નહીં.

ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ અને સીટી ઓફ બ્રેમ્પટન બાય-લો એન્ફોર્સમેન્ટ (પેટા-કાનૂનો અમલ-બજાવણી) સહિતની, સંખ્યાબંધ સેવાઓ રાખેતા મુજબ ચાલુ રહેશે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સિવિક હોલિડે વીકએન્ડ માટે નીચેનું સમયપત્રક અનુસરશે.

- શુક્રવાર, ઓગસ્ટ 2: વીકેડે સર્વિસ
- શનિવાર, ઓગસ્ટ 3: શનિવારની સેવા
- રવિવાર, ઓગસ્ટ 4: રવિવાર/રજાના દિવસની સેવા
- સોમવાર, ઓગસ્ટ 5 (સિવિક હોલિડે): રવિવાર/રજાના દિવસની સેવા

તમામ ટર્મિનલો, અને ક્લાર્ક એન્ડ સેન્ડલવૂડ સગવડોમાં ગ્રાહક સેવા કાઉન્ટર્સ, સિવિક હોલિડે નિમિત્તે બંધ રહેશે.

રૂટ અને સમયપત્રક માહિતી માટે, 905.874.2999 નંબર પર ફોન કોલ કરો અથવા વેબસાઈટ જુઓ, www.bramptontransit.com. રિયલ-ટાઈમ (વાસ્તવિક સમયે) આગામી બસ માહિતી મેળવવા તમારા સ્માર્ટ ફોન કે અન્ય મોબાઈલ સાધન પર વેબસાઈટ nextride.brampton.ca જુઓ. અન્ય ફેરાના આયોજનને લગતા સાધનો માટે વેબસાઈટ www.triplinx.ca અથવા ગૂગલ મેપ્સ જુઓ.

બ્રેમ્પટન રિક્રિએશન

મોટા ભાગની મનોરંજન સગવડો સિવિક હોલિડે વીકએન્ડ દરમિયાન ખુલ્લી રહે છે. અઘતન કાર્યક્રમ સમયપત્રકો અને સંચાલન ક્લાકો માટે, તમારા સ્થાનિક રિક્રિએશન સેન્ટરને ફોન કોલ કરો, 311 નંબર પર કોલ કરો અથવા વેબસાઈટ www.brampton.ca/recreation જુઓ. આ શહેરની રિક્રિએશન એડમિનિસ્ટ્રેશન ઓફિસ સિવિક હોલિડે નિમિત્તે બંધ રહેશે.

બ્રેમ્પટન એનિમલ સર્વિસીસ

બ્રેમ્પટન એનિમલ શેલ્ટર સિવિક હોલિડે નિમિત્તે બંધ રહેશે. વધુ માહિતી મેળવવા, 905.458.5800 અથવા 311 નંબર પર ફોન કોલ કરો, અથવા વેબસાઈટ જુઓ www.brampton.ca/animalservices.

ब्रेम्पटन वार्डब्रेरी

रविवार, ओगस्ट 4 अने सिविक डोविडेना रोज ब्रेम्पटन वार्डब्रेरीनी तमाम शाखाओ बंध रडेशे. वधु माडिती मेणववा, 905.793.4636 अथवा 311 नंबर पर डोन कॉल करो, अथवा वेबसाईट ज्युओ www.bramptonlibrary.com.

आतशबाळ सुरक्षा

सीटी ओड् ब्रेम्पटन सिविक डोविडे पर कोई आतशबाळ प्रदर्शन करशे नई.

सिविक डोविडे वर्ष दरमियानना अे चार टिवसो पैकी अेक नथी ज्यारे सीटी ओड् ब्रेम्पटनमां अंगत रीते आतशबाळ करवानी छूट आपवामां आवती डोय. वधु माडिती माटे वेबसाईट ज्युओ, www.brampton.ca/bylaws.

रडेवासीओने आगण कोई पूछपरछो करवा माटे सर्विस ब्रेम्पटनने 311 नंबर पर कॉल करवानुं कडेवामां आवे छे.

-30-

मिडिया संपर्क:

मोनिका डुग्गल

कोऑर्डिनेटर, मिडिया अेन्ड कम्युनिटी अेंगेजमेन्ट

व्यूडान्मक संवाद

सीटी ओड् ब्रेम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca